

TRAINING RECORD

Lift Training

13th April, 2017

Participants - 21



Important points to be discussed in this training

1. How to safely operate the lift: This includes knowledge of the lift controls, as well as how to safely board and disembark the lift.
2. Maximum capacity: Each lift has a maximum weight capacity and number of people that it can safely carry.
3. Proper use of safety features: All lifts should have safety features such as emergency stop buttons, alarms, and intercoms. It is important to understand how to properly use these features in the event of an emergency.


Registrar
Marwadi University



TRAINING SHEET

SUBJECT - <u>Lift Training</u>		INSTRUCTOR - <u>Kevaldam Pradhari</u>		SIGNATURE - <u>Kevaldam</u>
LOCATION - <u>Main Building MBL001</u>		ORGNAIZER NAME - <u>Muhammad Purnu</u>		DATE - <u>13/11/2018</u>
SR NO	NAME	DEPARTMENT	SIGNATURE	REMARKS
01	દાસી	SECURITY	દાસી	
02	અમીતભાઈ ભાગમી	"	A. B.	
03	મયંત શીંગાપુરી	"	મયંત શીંગાપુરી	
04	અમીતભાઈ શાંકરીયા	SECURITY	અમીતભાઈ	
05	વનરાજસીંહ ભડે	"	વનરાજસીંહ	
06	બાંસી ભડે	"	બાંસીભાઈ	
07	અમીતભાઈ ભડે	"	અમીતભાઈ	
08	કેશીભાઈ ભડે	"	કેશીભાઈ	
09	કેશીભાઈ ભડે	"	કેશીભાઈ	
10	ગોવિંદભાઈ ભડે	"	ગોવિંદભાઈ	
11	મણીભાઈ શાંકરીયા	"	મણીભાઈ શાંકરીયા	
12	દેવિપભાઈ શાંકરીયા	"	દેવિપભાઈ	
13	રામજીભાઈ શાંકરીયા	"	રામજીભાઈ	
14	શાંકરીયા શાંકરીયા	"	શાંકરીયા	
15	અમીતભાઈ ભડે	"	અમીતભાઈ	
16	અમીતભાઈ ભડે	"	અમીતભાઈ	
17	અમીતભાઈ શાંકરીયા	"	અમીતભાઈ	
18	અમીતભાઈ શાંકરીયા	"	અમીતભાઈ	
19	અમીતભાઈ ભડે	"	અમીતભાઈ	
20	અમીતભાઈ ભડે	"	અમીતભાઈ	
21	અમીતભાઈ ભડે	"	અમીતભાઈ	

Kevaldam
(DEPARTMENT INCHARGE)

(Signature)
(HEAD OF DEPARTMENT)

(Signature)
(VVP ADMIN)


(Signature)

TRAINING RECORD

CPR Training

04th May, 2017

Participants - 19



Following point discussed in the training

1. Understanding the Chain of Survival: The chain of survival is a concept that is taught in CPR training and is the sequence of steps that need to be taken in order for someone to have the best chance of surviving a cardiac arrest. The chain of survival includes early access to Emergency Medical Services, early CPR, early defibrillation, and early advanced care.
2. Recognizing Signs of Cardiac Arrest: The signs of cardiac arrest include sudden collapse, no pulse, and no breathing. It is important to be able to recognize the signs of cardiac arrest in order to respond quickly and appropriately.
3. Performing CPR: CPR stands for cardiopulmonary resuscitation and is a lifesaving technique that involves chest compressions and rescue breaths. It is important to be able to perform CPR correctly and confidently in order to increase the chance of survival.
4. Using an AED: An AED, or automated external defibrillator, is a medical device that can be used to restart a person's heart in the event of cardiac arrest. It is important for those trained in CPR to understand how to use an AED in order to provide the best chance of survival.

myadav
Registrar
Marwadi University



TRAINING SHEET




SUBJECT -		CPR Training		SIGNATURE -		[Signature]	
INSTRUCTOR -		Vijay Joshi		DATE -		04/05/2017	
LOCATION -		Main Building MB 201		SIGNATURE -		[Signature]	
ORGANIZER NAME -		Meharand Parth					
SR NO	NAME	DEPARTMENT	SIGNATURE	REMARKS			
1	Pravin Mandav	Admin	[Signature]				
2	Vijay Joshi	"	[Signature]				
3	Satyajit Jadhav	"	[Signature]				
4	Pranav Bhatt	"	[Signature]				
5	Rahul Sagathia	"	[Signature]				
6	Divyesh Tenim	"	[Signature]				
7	Jagdish Bhanu	"	[Signature]				
8	Jaganth Raval	"	[Signature]				
9	Mayank Sitaram	"	[Signature]				
10	Signesh Khatki	"	[Signature]				
11	Jyoteshwar Jadhav	"	[Signature]				
12	Abhay Chaudhari	"	[Signature]				
13	Mitu Nayak	"	[Signature]				
14	Pravin Dhondhari	"	[Signature]				
15	Pranav Padhari	"	[Signature]				
16	Ramesh Prasad	"	[Signature]				
17	Ushaben Prasad	"	[Signature]				
18	Pooja Prasad	"	[Signature]				
19	Pravinbhai Prasad	"	[Signature]				
20							
21							

Vijay
(DEPARTMENT INCHARGE)

[Signature]
(HEAD OF DEPARTMENT)

for
(VP ADMIN) [Signature]

TRAINING RECORD
Fire Fighting Training
28th June 2017
Participants - 18



The following points to be covered during the training:

1. Identifying different types of fire extinguishers and their appropriate uses.
2. Learning the PASS acronym (Pull, Aim, Squeeze, and Sweep) for fire extinguisher use.
3. Understanding how to select the right type of fire extinguisher for the specific fire hazard.
4. Knowing when it is safe and appropriate to use a fire extinguisher, and when emergency responders should be called.

myadep
Registrar
Marwadi University



TRAINING SHEET

SUBJECT - Fire Fighting Training		INSTRUCTOR - Vijay Joshi		SIGNATURE -	REMARKS
LOCATION - Wadi area		ORGAIZER NAME - Vijay Joshi		DATE - 28-06-2017	
SR NO	NAME	DEPARTMENT	SIGNATURE	REMARKS	
1	Pravin Mendal	Admin	[Signature]		
2	Vijay Joshi	"	[Signature]		
3	Satyajit Jadhav	"	[Signature]		
4	Ramesh Bhatt	"	[Signature]		
5	Rohit Suryakumar	"	[Signature]		
6	Divyesh Teriya	"	D. Teriya		
7	Jaydesh Bherudkar	"	J.D		
8	Jayam Prasad	"	[Signature]		
9	Murug Sitapuram	"	M.S.M		
10	Jignesh Muthi	"	J.17		
11	Jaydeshik Jadhav	"	J.K. Jadhav		
12	Ahmed Churhan	"	[Signature]		
13	Ravindrasinh Jadhav	"	[Signature]		
14	Rajan Vaghel	"	[Signature]		
15	Munshaji Marwani	"	[Signature]		
16	Alif Muroy	"	[Signature]		
17	Pravin Dandekar	"	[Signature]		
18	Jaydeshik Chudasekar	"	[Signature]		

Vijay

(DEPARTMENT INCHARGE)

[Signature]

(HEAD OF DEPARTMENT)

[Signature]

(VP ADMIN)

TRAINING RECORD
Fire Fighting Training
12th August 2017
Participants - 28



Following points were discussed during the training:

Explain about the use and importance of different types of fire extinguishers available, such as dry chemical, carbon dioxide, and water mist, so that employees are aware of which type is best suited for their workplace. Provide practical training in use of different type of fire extinguishers

mpitaleja
Registrar
Marwadi University



TRAINING SHEET

SUBJECT - Fire fighting Training		INSTRUCTOR - Satyul Jadey		SIGNATURE -	REMARKS
LOCATION - Near Hostel - C		ORGAIZER NAME - Mahanand Parth		DATE - 12.08.2018	
SR NO	NAME	DEPARTMENT	SIGNATURE	REMARKS	
1	Satyul Jadey	Admin	Satyul		
2	Dhamesh Bhutt	"	DBB		
3	Rahul sagathiya	"	R		
4	Divyesh Teniya	"	Tenny		
5	Jadish Dhamesh	"	J. D		
6	Jayant Ramul	Admin	Jar		
7	Muxun Sitarany	"	M.S		
8	Jignesh Leathi	"	J.H		
9	Jaydevshil Jadey	"	J.D Jadey		
10	Akhay Chandan	"	A		
11	Rajan Vaghel	"	Rajan		
12	Nitya Nyay	"	Nitya		
13	Pravin Parmodhani	"	P.P		
14	Jayashil Chandan	"	J.C		
15	Pravin Munder	"	P.M		
16	Vijay Gashi	"	V.G		
17	Ravindrasiroh Jadey	R. Jadey	R. Jadey		
18	Banash Padheriya	"	B.P		
19	Vamanshil Jadey	"	V.J		
20	Ramesh Poojapal	"	R.P.		
21	Bhudar Bhai	"	B.B		
22	Pravinbhai Totred	"	P.T		
23	Pratimubon Totred	"	P.T		
24	Ushaben Jabametry	"	U.J		
25	Parash Vaghel	"	V.P.		
26	Pankaj Ramya	"	P.R		
27	Ajit Chavda	"	A.C		
28	Mamoy Savani	"	Mamoy		

Satyul
(DEPARTMENT INCHARGE)

Pravin
(HEAD OF DEPARTMENT)

Amr
(SVP ADMIN)

TRAINING RECORD
Fire Fighting Training
16th January 2018
Participants - 18



The following points were discussed during the training:

Explain to the employees and make them aware of the potential hazards associated with using fire extinguishers, such as the risk of inhalation of extinguishing agents and the possibility of the fire re-igniting after the extinguisher has been used. The correct way to hold and use the equipment must be explained and given practice.


Registrar
Marwadi University



TRAINING SHEET

SUBJECT - Fire Fighting Training		SIGNATURE - <i>Jagdish</i>		
INSTRUCTOR - Satyapal Singh Jadeja		DATE - 15-01-2018		
LOCATION - Wadi area		SIGNATURE - <i>R. J.</i>		
ORGANIZER NAME - Muhammad Parth				
SR NO	NAME	DEPARTMENT	SIGNATURE	REMARKS
01	Pravin Mundel	Admin	<i>Pravin</i>	
02	Rajan Vaghela	"	<i>Rajan</i>	
03	Jayant Parat	Admin	<i>Jayant</i>	
04	Rohit Saythiga	"	<i>Rohit</i>	
05	Dharmesh Bhatt	"	<i>DPB</i>	
06	Dinest Tadariga	"	<i>Tadariga</i>	
07	Minaxi Maswani	"	<i>Minaxi</i>	
08	Jagdev Jadeja	"	<i>J. K. Jadeja</i>	
09	Bhupendra Tala	"	<i>B. J.</i>	
10	Sanul Madam	"	<i>R. J.</i>	
11	Ravindrasinh Jadeja	"	<i>R. Jadeja</i>	
12	Vanshrajsinh Jadeja	"	<i>V. J.</i>	
13	Manoj Savani	"	<i>M. B.</i>	
14	Ramesh Prajapati	"	<i>R. P.</i>	
15	Ushaben Gabampada	"	<i>Ushaben</i>	
16	Satyupal Jadeja	"	<i>Satyupal</i>	
17	Abhay Chaudhary	"	<i>Abhay</i>	
18	Vijay Joshi	"	<i>Vijay</i>	

Jagdish
(DEPARTMENT INCHARGE)

Pravin
(HEAD OF DEPARTMENT)

Sanul
(SVP ADMIN)

TRAINING RECORD
First Aid Training
23rd February 2018
Participants – 22



The following points were discussed in the training

1. Recognizing signs of illness and Injury: It is important to learn how to recognize the signs and symptoms of common illnesses and injuries, and how to respond to them appropriately.
2. Administering Medication: It is important to discuss the correct way to administer medication, such as how to measure and administer the correct dosage, and what medications are safe to give to specific individuals.
3. Evacuation method and taking help of the ambulance facility must also be known to all.
4. Training on putting bandages and use of correct first aid medicines must be known.

myadep
Registrar
Marwadi University





TRAINING SHEET

SUBJECT - <u>First Aid Training</u>		INSTRUCTOR - <u>Vidya Joshi</u>		SIGNATURE - <u>Vidya</u>
LOCATION - <u>Main Building MA 201</u>		ORGNAIZER NAME - <u>Mahendra Patil</u>		DATE - <u>25/2/2018</u>
SR NO	NAME	DEPARTMENT	SIGNATURE	REMARKS
1	Pavani Mansur	Admin	<u>Pavani</u>	
2	Vidya Joshi	"	<u>Vidya</u>	
3	Satyajit Jadhav	Admin	<u>Satyajit</u>	
4	Dharmesh Bhandari	"	<u>DB</u>	
5	Rahul Sagathia	"	<u>Rahul</u>	
6	Divyesh Tomiya	"	<u>Divyesh</u>	
7	Jagdish Bhandarkar	"	<u>J.B</u>	
8	Jayant Rawal	Admin	<u>Jayant</u>	
9	Meyank Satepur	"	<u>Meyank</u>	
10	Jignash Patil	"	<u>J.P</u>	
11	Jaydevshik Jadhav	"	<u>J.D. Jadhav</u>	
12	Abhay Chauhan	"	<u>Abhay</u>	
13	Rajan Vaghel	"	<u>Rajan</u>	
14	Rurindrasin Jadhav	"	<u>R.J</u>	
15	Alita Nayan	"	<u>Nitul</u>	
16	Pavani Dhanekar	"	<u>P.P</u>	
17	Jayashil Chudasmani	"	<u>Jayshil</u>	
18	Pankaj Padhemiya	"	<u>P.P</u>	
19	Meyank Satepur	"	<u>Satepur</u>	
20	Dharmesh Pratejapati	"	<u>R.P</u>	
21	Ushaben Gobin Patil	"	<u>Ushaben</u>	
22	Pratima Patil	"	<u>Pratima</u>	

Vidya
(DEPARTMENT INCHARGE)

M. Patil
(HEAD OF DEPARTMENT)



Patil
(SVP ADMIN)

TRAINING RECORD

First Aid Training

27th March 2018

Participants - 22



Important points that were discussed during the training

1. Basic First Aid: Participants should learn the basics of first aid, such as how to recognize and treat common injuries and illnesses. How to properly administer CPR, and how to use a defibrillator.
2. Injury Prevention: Participants should learn how to recognize and address potential hazards in their home and workplace. This includes learning how to properly store hazardous items, such as cleaning supplies, and how to use safety equipment, such as fire extinguishers and smoke detectors.
4. Chemical Hazards: Participants should learn how to recognize and address potential chemical hazards, such as carbon monoxide poisoning, as well as how to use personal protective equipment, such as face masks and gloves.
5. Communicable Diseases: Participants should learn how to recognize and respond to communicable diseases, such as influenza, as well as how to properly use and dispose of personal protective equipment, such as face masks and gloves. Covid precautions are to be known to all

Registrar
Registrar
Marwadi University





TRAINING SHEET



SUBJECT - <u>First Aid Training.</u>			SIGNATURE - <u>Vijay</u>	
INSTRUCTOR - <u>Vijay Joshi</u>			DATE - <u>27/3/2018</u>	
LOCATION - <u>Mun Building MA 201</u>			SIGNATURE - <u>Vijay</u>	
ORGAIZER NAME - <u>Mahamud Parthi</u>				
SR NO	NAME	DEPARTMENT	SIGNATURE	REMARKS
01	Pravin Mandak	Admin	<u>Pravin</u>	
02	Rahul Saythiya	"	<u>Rahul</u>	
03	Dheemesh Bhatt	"	<u>Dheemesh</u>	
04	Maryam Sidupara	"	<u>Maryam</u>	
05	Jignesh Hedhi	"	<u>Jignesh</u>	
6	Satypalsinh Jaleja	"	<u>Satypalsinh</u>	
7	Vijay Joshi	"	<u>Vijay</u>	
8	Jayrajsinh chudasani	"	<u>J.C</u>	
9	Vidya Nagark	"	<u>Vidya</u>	
10	Abhy Chankam	"	<u>Abhy</u>	
11	Jaydev Jaleja	"	<u>J.D. Jaleja</u>	
12	Dinyesh Taraji	"	<u>Dinyesh</u>	
13	Mimmi meswar	"	<u>Mesumi</u>	
14	Rajen Vagle	"	<u>Rajen</u>	
15	Ravindersinh Jaleja	"	<u>R.J.</u>	
16	Ramesh Rajapadi	"	<u>R.P</u>	
17	Munraj Bavani	"	<u>Munraj</u>	
18	Bhawan Teivedi	"	<u>Bhawan Teivedi</u>	
19	Usuben Jabamputra	"	<u>Usuben</u>	
20	Pratimaben Teivedi	"	<u>Pratimaben</u>	
21	Prakash Pacherija	"	<u>Prakash</u>	
22	Vamrajsinh Jaleja	"	<u>V.J.</u>	

Vijay
(DEPARTMENT INCHARGE)

parthi
(HEAD OF DEPARTMENT)

Parthi
(SVP ADMIN)

TRAINING RECORD
Fire Fighting Training
16th July 2018
Participants - 22



Following points were discussed during the training:

Fire extinguisher training is an important part of any workplace safety program. It is important for employers to ensure that their employees are properly trained on the use of fire extinguishers and other fire safety equipment.

The training should also contain some quiz to recollect and recapture the lessons taught. The participants must be aware of the precaution and the safety checks of the equipments.

Signature
Registrar
Marwadi University



TRAINING SHEET

SUBJECT - Fire Fighting Training		SIGNATURE - <i>[Signature]</i>		
INSTRUCTOR - Satyalsinh Jadhav		DATE - 16-07-2014		
LOCATION - Wadi area		SIGNATURE - <i>[Signature]</i>		
ORGNAIZER NAME - Mukund Patil				
SR NO	NAME	DEPARTMENT	SIGNATURE	REMARKS
01	Pavitra Manabhai		<i>[Signature]</i>	
02	Vijay Joshi		<i>[Signature]</i>	
03	Rajam Vaghela		<i>[Signature]</i>	
04	Jyotir Raval	Admin	<i>[Signature]</i>	
05	Maryam Sitapara		<i>[Signature]</i>	
06	Rohit Saigathiya		<i>[Signature]</i>	
07	Jignesh Hathi		J.H	
08	Jyotish Bhandarvad		J.B	
09	Satyajit Jadhav		<i>[Signature]</i>	
10	Dinmesh Tawarika		<i>[Signature]</i>	
11	Anbhay Chavan		<i>[Signature]</i>	
12	Dharmesh Bhatt		<i>[Signature]</i>	
13	Munshi Marwari		Marwari	
14	Jyotay Jadhav		J.R.Jadhav	
15	Ravindraasish Jadhav		<i>[Signature]</i>	
16	Bhupenalsinh Zale		<i>[Signature]</i>	
17	Sonal Pindam		Sonal	
18	Ravindra Jadhav		R.J.	
19	Vandatsinh Jadhav		V.J	
20	Mamaj Savani		Savani	
21	Ramesh Prayapati		R.P	
22	Usaben Jabimputhe		<i>[Signature]</i>	

[Signature]
(DEPARTMENT INCHARGE)

[Signature]
(HEAD OF DEPARTMENT)

[Signature]
(SVP ADMIN)

TRAINING RECORD
Security Training
17th November 2018
Participants - 24



Following point discussed during training.

1. Security guards should always be alert and vigilant while on duty.
2. Security guards should be aware of the campus policies and procedures for student safety.
3. Security guards should be familiar with the layout of the campus and all buildings.
4. Security guards should be familiar with the emergency response plans and procedures in case of an emergency.
5. Security guards should be able to identify potential safety hazards and take appropriate action to prevent them.
6. Security guards should be familiar with the appropriate use of security equipment, such as radios, cameras, and access control systems.
7. Security guards should be able to effectively communicate with students, faculty and staff.

nyaidya
Registrar
Marwadi University



TRAINING SHEET


SUBJECT - Security Training		SIGNATURE - Ravindrasinh		
INSTRUCTOR - Ravindrasinh Jadhav		DATE - 12/11/2018		
LOCATION - Neeru Building		SIGNATURE - Mahesh		
ORGAIZER NAME - Mahesh				
SR NO	NAME	DEPARTMENT	SIGNATURE	REMARKS
01	સુશીલ ગણેશી	Security	સુશીલ	
02	નરસીંગ રાવેશી	"		
03	મનુષ્ય રાવેશી	"		
04	યુવક રાવેશી	"	મનુષ્ય	
05	સુશીલ રાવેશી	"	સુશીલ	
06	સુશીલ રાવેશી	"	સુશીલ	
07	સુશીલ રાવેશી	"	સુશીલ	
08	સુશીલ રાવેશી	Security	સુશીલ	
09	સુશીલ રાવેશી	"	સુશીલ	
10	સુશીલ રાવેશી	"	સુશીલ	
11	સુશીલ રાવેશી	"		
12	સુશીલ રાવેશી	"		
13	સુશીલ રાવેશી	"	સુશીલ	
14	સુશીલ રાવેશી	"	સુશીલ	
15	સુશીલ રાવેશી	"	સુશીલ	
16	સુશીલ રાવેશી	"	સુશીલ	
17	સુશીલ રાવેશી	"	સુશીલ	
18	સુશીલ રાવેશી	"	સુશીલ	
19	સુશીલ રાવેશી	"		
20	સુશીલ રાવેશી	"	સુશીલ	
21	સુશીલ રાવેશી	"	સુશીલ	
22	સુશીલ રાવેશી	"	સુશીલ	
23	સુશીલ રાવેશી	"	સુશીલ	
24	સુશીલ રાવેશી	"	સુશીલ	

Ravindrasinh
(DEPARTMENT INCHARGE)

Mahesh
(HEAD OF DEPARTMENT)

Mahesh
(SVP ADMIN)

TRAINING RECORD
Fire Fighting Training
11th April 2019
Participants – 16



Following points were discussed during training:

Explain the proper use of fire extinguishers, such as the P.A.S.S. technique (pull, aim, squeeze, and sweep). This includes explaining how to properly aim the extinguisher, how to squeeze the trigger, and how to sweep the stream of extinguishing agent across the fire.

Brief the working staff on the types of fires and how to address each type of fire.

Myadeta
Registrar
Marwadi University



TRAINING SHEET




SUBJECT - Fire Fighting Training			SIGNATURE - <i>[Signature]</i>	
INSTRUCTOR - Sufyaul Islam Jadedga			DATE - 11-04-2019	
LOCATION - wadi well			SIGNATURE - <i>[Signature]</i>	
ORGANIZER NAME - Mahanand Parit				
SR NO	NAME	DEPARTMENT	SIGNATURE	REMARKS
01	Vijay Joshi	Admin	<i>[Signature]</i>	
02	Rahul Sayathiya	"	<i>[Signature]</i>	
03	Dharmesh Bhatt	"	<i>[Signature]</i>	
04	Pavan Mandel	"	<i>[Signature]</i>	
05	Seetopal Jadedga	"	<i>[Signature]</i>	
06	Divyesh Tailaiya	"	<i>[Signature]</i>	
07	Jignesh Hathi	"	J.H	
08	Minaxi Marwani	"	Marwani	
09	Rajan Vaghela	"	Rajan	
10	Ravinchandra Jadedga	"	<i>[Signature]</i>	
11	Jaydev Jadedga	"	J.D Jadedga	
12	Jagdish Bhambhani	"	J.B	
13	Jaganat Raval	Admin	<i>[Signature]</i>	
14	Mayank Sitapara	"	<i>[Signature]</i>	
15	Abhay Chavhan	"	<i>[Signature]</i>	
16	Prakash Padheriya	"	<i>[Signature]</i>	

[Signature]
(DEPARTMENT INCHARGE)

[Signature]
(HEAD OF DEPARTMENT)

[Signature]
(SVF ADMIN)

TRAINING RECORD
First Aid Training
10th May 2019
Participants – 21



The following points were covered during the training

1. Knowing how to respond to a choking victim is an important part of first aid training. Participants should learn how to recognize signs and symptoms of choking, how to safely remove an object from the throat, and how to perform abdominal thrusts.
2. Understanding the signs and symptoms of shock, as well as how to provide first aid for victims of shock, is essential for first aid training.
3. Participants should be taught how to recognize, control, and treat external and internal bleeding. The aspect of dehydration and the prevention methods must be known to all.
4. Knowing how to respond to different types of burns—including thermal, chemical, electrical, and radiation burns—is also important for first aid training.

myadepa
Registrar
Marwadi University





TRAINING SHEET

SUBJECT - First Aid Training		INSTRUCTOR - Vijay Jashi		SIGNATURE -	Vijay Jashi
LOCATION - Main Building MB301		ORGAIZER NAME - Muhammad Parth		DATE -	10/5/2019
SR NO	NAME	DEPARTMENT	SIGNATURE	REMARKS	
1	Vijay Jashi	Admin	Vijay		
2	Satyajeel Jadhav	"	Jadhav		
3	Dhanraj Bhatt	"	DB		
4	Rahul sagathiy	"	Rahul		
5	Divyesh Jemba	"	Jemba		
6	Jagdish Bhandarkar	"	J.B		
7	Jayant Rural	Admin	Jayant		
8	Pratibha Privedi	"	Pratibha		
9	Ushaben Jobanputra	"	Ushaben		
10	Ramesh Poojapati	"	R.P		
11	Mayank Sitapure	"	M.S		
12	Prakash Pudekar	"	P.P		
13	Jayashil Chaudhary	"	J.C		
14	Pooja Dandekar	"	Pooja		
15	Alfa Nayak	"	Alfa		
16	Arvindsinh Jadhav	"	A.J		
17	Rajan Vaghare	"	R.V		
18	Abhay Chaudhary	"	Abhay		
19	Jignesh Kuthi	"	J.K		
20	Jayashil Jadhav	"	J.K Jadhav		
21	Jignesh	"	Jignesh		

Vijay
(DEPARTMENT INCHARGE)

Prakash
(HEAD OF DEPARTMENT)


Parth
(SVP ADMIN)

TRAINING RECORD

Lift Training

29th June, 2019

Participants - 11



Following point discussed in the training

1. Proper maintenance: All lifts should receive regular maintenance to ensure proper operation. Knowing how to spot potential problems and how to report them is also important. Ensure Insurance and license is always complete.
2. Understanding of laws and regulations: It is important to understand the laws and regulations that govern the use of lifts in order to ensure proper operation and safety.

myadaya
Registrar
Marwadi University



TRAINING SHEET

SUBJECT -		Instructor -		SIGNATURE-
LOCATION -		ORGNAIZER NAME		DATE-
SR NO	NAME	DEPARTMENT	SIGNATURE	REMARKS
01	સેચ્યુરિટી સીઈડીઆઇ	security	સેચ્યુરિટી	
02	પુલકીઆઇ સુડેશી	"	સુડેશી	
03	સિદ્ધિઆઇ સપ્તાઈ	"	સિદ્ધિઆઇ	
04	અભયઆઇ સુ	"	અભય	
05	મીનું. સુધ્યઆઇ	"	સુધ્ય	
06	સાકુઆઇ સદેવ	"	સદેવ	
07	લીલાબેન મધ્યાલમ	"	મધ્યાલમ	
08	પુષ્પાઆઇ પુલકીઆઇ	"	પુષ્પાઆઇ	
09	પ્રમીલીઆઇ પુષ્પાઆઇ	"	પ્રમીલીઆઇ	
10	સુધ્યઆઇ મમ્યા	"	સુધ્યઆઇ	
11	બીમકુઆઇ લાલ	"	બીમકુઆઇ	

Kevaldem
(DEPARTMENT INCHARGE)

P. G. Jethava
(HEAD OF DEPARTMENT)

Santhosh
(SVP ADMIN)

TRAINING RECORD

CRP Training

31st July, 2019

Participants - 18



Following points were discussed during the training

1. Recognize the signs of cardiac arrest: During CPR training, it is important to discuss how to recognize the signs of cardiac arrest. These signs include sudden collapse, no breathing, no pulse, and unconsciousness.
2. Perform chest compressions: During CPR training, it is important to discuss how to perform chest compressions. This includes proper hand placement, depth of compression, and rate of compression.


Registrar
Marwadi University



TRAINING SHEET


SUBJECT -		CPR Training				
INSTRUCTOR -		Vijay Joshi		SIGNATURE -	Vijay	
LOCATION -		Main Building MA305			DATE -	31/7/2019
ORGAIZER NAME -		Maheshwar Parth			SIGNATURE -	Vijay
SR NO	NAME	DEPARTMENT	SIGNATURE	REMARKS		
01	Pearvin Mundel	Admin	P. Mundel			
02	Rahul Sagthiya	"	R. Sagthiya			
03	Dharmesh Bhatt	"	D. Bhatt			
04	Satyajit Jadhav	"	S. Jadhav			
05	Abhay Chavhan	"	A. Chavhan			
06	Jaydev Jadhav	"	J. Jadhav			
07	Vijay Joshi	"	V. Joshi			
08	Mayank Sitapara	"	M. Sitapara			
09	Jignesh Hathi	"	J. Hathi			
10	Jayesh Chudasari	"	J. Chudasari			
11	Nitu Rajee	"	N. Rajee			
12	Dinash Taxaija	"	D. Taxaija			
13	Rajan Vaghela	"	R. Vaghela			
14	Ramesh Pragasani	"	R. Pragasani			
15	Pooja Toivale	"	P. Toivale	(12/15)		
16	Vandana Jadhav	"	V. Jadhav			
17	Minali Marwani	"	M. Marwani			
18	Ravindra Jadhav	"	R. Jadhav			

Vijay
(DEPARTMENT INCHARGE)

Parth
(HEAD OF DEPARTMENT)

Parth
(SVP ADMIN)

TRAINING RECORD
Driver Safety Training
14th Aug, 2019
Participants - 19



Assistance of RTO personals were taken for Training. The following points were discussed during the training

1. **Defensive Driving:** Drivers should be trained on how to anticipate and avoid dangerous situations. This includes understanding the importance of obeying the speed limit, allowing enough time for stopping, and avoiding distractions such as talking on the phone or texting while driving.
2. **Vehicle Maintenance:** Drivers should be well-versed in the proper maintenance of their vehicle. This includes knowing how to check their oil, tires, and brakes, as well as how to properly secure any cargo.
3. **Alcohol and Drug Use:** Drivers should be made aware of the risks associated with driving under the influence of drugs and alcohol, as well as the laws and regulations that govern them.
4. **Sharing the Road:** Drivers should understand the importance of sharing the road with cyclists, pedestrians, and other vehicles. They should also be aware of the laws and regulations that govern their behaviour.

myadega
Registrar
Marwadi University



TRAINING SHEET



SUBJECT - TRAFFIC SAFETY			SIGNATURE- <i>J. Shah</i>	
INSTRUCTOR - MR. J. Y. SHAH			DATE- 4/08/2019	
LOCATION - SEMINAR HALL			SIGNATURE- <i>Rajendra Vadliya</i>	
ORGAIZER NAME- RAJENDRA VADLIYA				
SR NO	NAME	DEPARTMENT	SIGNATURE	REMARKS
1.	Hitesh Acharya	Transport	<i>H.G. Acharya</i>	
2.	BHARAT SIRODIA	Transport	<i>mami</i>	
3.	BHANUBHAI BORICHA	Transport	<i>mami</i>	
4.	DEEPAK SUNDHAR	Transport	<i>Kusankar</i>	
5.	NAVCHAN MUR	Transport	<i>देवेंद्र</i>	
6.	RANJITSINH PARMAR	Transport	<i>रंजित पारमार</i>	
7.	SANDIP JETHA	Transport	<i>S.J.</i>	
8.	RANMAL SAUSETA	Transport	<i>रंमल सावसेता</i>	
9.	MAHENDRASINH ZALA	Transport	<i>MZ</i>	
10.	MAHMADRAFIK SAIZAD	Transport	<i>महमदराफिक सायद</i>	
11.	RAMESH MAKHELA	Transport	<i>रमेश माखेला</i>	
12.	VANRAJISINH PARMAR	Transport	<i>V.P.</i>	
13.	SHAKTISINH PARMAR	Transport	<i>शक्ति सिंह पारमार</i>	
14.	RAJESH TRIVEDI	Transport	<i>राजेश त्रिवेदी</i>	
15.	KANUBHAI SOLANKI	Transport	<i>कांठुभाई सोलंकी</i>	
16.	SANJAY TILAVAT	Transport	<i>S.T.</i>	
17.	MAHENDRASINH JADEJA	Transport	<i>महेश जडेजा</i>	
18.	MANSUKHBHAI PAMBHAR	Transport	<i>मंसूखभाई पामभार</i>	
19.	DEVJIBHAI MAZYAD	Transport	<i>देवजीभाई माड्याड</i>	

J. Y. Shah
 (DEPARTMENT INCHARGE)

Rajendra Vadliya
 (HEAD OF DEPARTMENT)

Amr
 (SVP ADMIN)

TRAINING RECORD
Housekeeping Training
23rd September, 2019
Participants – 18



Following points were discussed during the training.

1. **Cleaning Techniques:** Staff should be trained on proper cleaning techniques, such as how to clean various surfaces, how to use various cleaning tools, and how to clean efficiently.
2. **Safety and Security:** Housekeeping staff should be trained on how to identify and respond to safety and security risks, such as identifying suspicious persons or activities, and how to respond to emergencies.
3. **Infection Control:** Housekeeping staff should be trained on how to prevent the spread of infection, such as proper hand washing techniques, and how to properly clean and sanitize surfaces.
4. **Quality Control:** Housekeeping staff should be trained on how to identify problems and report them to management, as well as how to handle customer complaints.

Handwritten signature
Registrar
Marwadi University





TRAINING SHEET




SUBJECT - Housekeeping Training			SIGNATURE-	
INSTRUCTOR - Mahmand pant			DATE- 23 09 19	
LOCATION - MB201			SIGNATURE-	
ORGAIZER NAME- SATAPAL JADEJA				
SR NO	NAME	DEPARTMENT	SIGNATURE	REMARKS
1.	ગાઈડાન્સ અધિકારી	HKT	ગાઈડાન્સ	
2.	સીનિયર અધિકારી	"	સીનિયર	
3.	ગાઈડાન્સ અધિકારી	"	ગાઈડાન્સ	
4.	સ્ટેજ અધિકારી	"	HECHESY	
5.	સ્ટેજ ઓફિસ	"	NBV	
6.	સીનિયર અધિકારી	"	સીનિયર	
7.	સીનિયર અધિકારી	"	RR	
8.	સીનિયર અધિકારી	"	MV	
9.	સીનિયર અધિકારી	"	સીનિયર	
10.	સીનિયર અધિકારી	"	સીનિયર	
11.	સીનિયર અધિકારી	"	GS	
12.	સીનિયર અધિકારી	"	SSA	
13.	સીનિયર અધિકારી	"	MBV	
14.	સીનિયર અધિકારી	"	સીનિયર	
15.	સીનિયર અધિકારી	"	Tidy	
16.	સીનિયર અધિકારી	"	સીનિયર	
17.	સીનિયર અધિકારી	"	સીનિયર	
18.	સીનિયર અધિકારી	"	સીનિયર	

(DEPARTMENT INCHARGE)

(HEAD OF DEPARTMENT)

(SVP ADMIN)

TRAINING RECORD
Fogging Technique Training
22nd October, 2019
Participate - 21



Following point discussed during the training:

Fogging Technique Training is an important aspect of any fogging operation, and should be discussed in any training program. It is important to understand the different types of fogging and how to use each type safely and effectively. Training should also include instruction on the proper maintenance and storage of fogging equipment.

mydeya
Registrar
Marwadi University



TRAINING SHEET


SUBJECT - <i>Training on Fogging Technique.</i>			SIGNATURE - <i>Abhay</i>	
INSTRUCTOR - <i>Abhay Chaudhari</i>			DATE - <i>22-10-2019</i>	
LOCATION - <i>MCO18</i>			SIGNATURE - <i>Pravin</i>	
ORGNAIZER NAME - <i>Mahendrapur</i>				
SR NO	NAME	DEPARTMENT	SIGNATURE	REMARKS
1	Jaydersinh Jadedga	Admin	J. K. Jadedga	
2	Tighesh Dathi	Admin	<i>[Signature]</i>	
3	Paras vaghela	Admin	<i>[Signature]</i>	
4	Pankaj Rathva	Admin	<i>[Signature]</i>	
5	Rahul sagathiya	Admin	<i>[Signature]</i>	
6	Ajit chavda	Admin	<i>[Signature]</i>	
7	Krishnapalsinh Jadedga	Admin	<i>[Signature]</i>	
8	Dharmesh bhatt	Admin	<i>[Signature]</i>	
9	Jayant Ravai	Admin	<i>[Signature]</i>	
10	Rajan vaghela	Admin	<i>[Signature]</i>	
11	Vijay Joshi	Admin	<i>[Signature]</i>	
12	Kalpesh Sagathiya	Admin	<i>[Signature]</i>	
13	Pravin mandre	Admin	<i>[Signature]</i>	
14	Divjesh Tetiya	Admin	<i>[Signature]</i>	
15	Jagdish Bhadravvaya	Admin	<i>[Signature]</i>	
16	Manank Sitapara	Admin	<i>[Signature]</i>	
17	Minaxi Narwani	Admin.	M. N. Narwani	
18	Ravindraasinh Jadedga	Admin	<i>[Signature]</i>	
19	Kalpesh sagathiya	Admin	<i>[Signature]</i>	
20	Sagar Rathod	Admin	<i>[Signature]</i>	
21	Amardeepsinh Jadedga	Admin.	<i>[Signature]</i>	

Abhay
(DEPARTMENT INCHARGE)

Pravin
(HEAD OF DEPARTMENT)

[Signature]
(SVP ADMIN)

TRAINING RECORD
Security Training
2nd November, 2019
Participants - 22





The following points were discussed during the training:

1. Explain the emergency response protocol. Make sure the security guard knows whom to contact and how to react in an emergency situation.
2. Explain the security guard's role in supervising students on campus. Discuss the consequences of not following the rules or engaging in inappropriate behavior.
3. Explain the importance of reporting incidents and suspicious activity. Provide the security guard with the necessary forms and instructions for how to report incidents.
4. Hostel security. Security persons of Hostels function under wardens and will be responsible to all support required. Things beyond Hostel where support is asked by Wardens, the supervisor will provide immediately.

madhvi
Registrar
Marwadi University



TRAINING RECORD
Training on cleaning procedures for House Keeping staff
12th December, 2019
Participants – 30





Following points were discussed during training


1. Chemicals should be stored in a secure area that is well ventilated and away from food, beverages, and other non-chemical cleaners.
2. All containers must be labelled clearly with the name of the chemical, its concentration, and the hazard warning. All chemicals should be diluted correctly according to the product's instructions.
3. All containers must be disposed of correctly and according to local regulations. Regular monitoring should be done to ensure that the use of chemicals is safe and the products are being used correctly.



Registrar
Marwadi University




TRAINING SHEET




SUBJECT - Training on cleaning procedures for housekeeping staff		INSTRUCTOR - Mr. Abhay Chauhan		SIGNATURE - 
LOCATION - Seminar hall		DATE - 12/12/17		SIGNATURE - 
ORGAIZER NAME - Mr. Abhay Chauhan				
SR NO	NAME	DEPARTMENT	SIGNATURE	REMARKS
1.	મીનાબેન વડવાર	HK	m.v	
2.	વિજયબેન પરમાર	"	vijayben	
3.	દિગ્દાસી શાહ	"	Digdas	
4.	પુષ્પાબેન દેવાણા	"	Pushpa	
5.	શીતલબેન મહેતા	"	Sheetal	
6.	કિશોરબેન દાસરાણી	"	Kishor	
7.	પુષ્પાબેન શેલ	"	P.S	
8.	દેવદાસી રાણીયા	"	D.T.T	
9.	ગણેશબેન શાહ	"	Ganesh	
10.	જયલક્ષ્મી મહેતા	"	J.M	
11.	દેવદાસી રાણીયા	"	Devdas	
12.	વિજયબેન દાસરાણી	"	Vijay	
13.	ગણેશબેન શાહ	"	Ganesh	
14.	દેવદાસી રાણીયા	"	Devdas	
15.	જયલક્ષ્મી શેલ	"	Jaylaxmi	
16.	ગણેશબેન શાહ	"	Ganesh	
17.	વિજયબેન રાણીયા	"	Vijay	
18.	દેવદાસી પરમાર	"	Devdas	
19.	જયલક્ષ્મી મહેતા	"	Jaylaxmi	
20.	પુષ્પાબેન દેવાણા	"	Pushpa	
21.	શયમલબેન દાસરાણી	HK	Shyam	
22.	દેવદાસી શાહ	"	Devdas	
23.	દિગ્દાસી મહેતા	"	Digdas	
24.	શીતલબેન શાહ	"	Sheetal	
25.	કિશોરબેન શેલ	"	Kishor	
26.	જયલક્ષ્મી મહેતા	"	Jaylaxmi	
27.	પુષ્પાબેન રાણીયા	"	Pushpa	
28.	દેવદાસી શાહ	"	Devdas	
29.	શયમલબેન દાસરાણી	"	B.A	
30.	શયમલબેન મહેતા	"	S.M	


(DEPARTMENT INCHARGE)


(HEAD OF DEPARTMENT)


(SVP ADMIN)

TRAINING RECORD
Fire Fighter Training
31st January, 2020
Participants – 18



Following points were discussed during training

1. Familiarize yourself with the types of fire extinguishers and the types of fires. Explain about how the different types of fire extinguishers are designed to fight different types of fires.
2. Make sure the extinguisher you are using is charged and pressurized. Make sure all of the seals are intact and the pressure gauge indicates the extinguisher is ready for use.
3. Pull the pin at the top of the extinguisher and hold the extinguisher with the nozzle pointing away from you.
4. Aim the nozzle at the base of the fire. Stand at least 8 feet away from the fire.
5. Squeeze the handle to discharge the extinguishing agent. Sweep the nozzle from side to side in a sweeping motion.


Registrar
Marwadi University







TRAINING RECORD

Training on cleaning procedures for House Keeping staff

6th February, 2020

Participants – 30



Following Point Discussed during the training


1. Proper Use of authorised Chemicals: It is important to teach employees how to properly use approved chemicals, including how to read labels, use protective equipment, and store chemicals safely.
2. Proper Disposal of Trash and Recycling: Staff should be trained on how to properly dispose of trash, including how to separate recyclables.
3. Cleaning Techniques: Staff should be trained on proper cleaning techniques, such as how to clean various surfaces, how to use various cleaning tools, and how to clean efficiently.
4. Safety and Security: Housekeeping staff should be trained on how to identify and respond to safety and security risks, such as identifying suspicious persons or activities, and how to respond to emergencies.
5. Infection Control: Housekeeping staff should be trained on how to prevent the spread of infection, such as proper hand washing techniques, and how to properly clean and sanitize surfaces.
6. Quality Control: Housekeeping staff should be trained on how to identify problems and report them to management, as well as how to handle customer complaints.


Nijadeya
Registrar
Marwadi University




TRAINING SHEET

SUBJECT - Training on cleaning procedures for Housekeeping staff				
INSTRUCTOR - Mr. Abhay Chauhan			SIGNATURE-	DATE-
LOCATION - MB301			SIGNATURE-	DATE-
ORGAIZER NAME- Mr. Satyapal Jadhav			SIGNATURE-	DATE-
SR NO	NAME	DEPARTMENT	SIGNATURE	REMARKS
1	पुष्पाजी गुप्त	HR	पुष्पा	
2	जयुजीम मडवाडा	"	जयुजीम	
3	दिपाजी मेरालीया	"	दिपाजी	
4	ज्याम सावडा	"	ज्याम	
5	अंजुजीम रासोडी	"	अंजुजीम	
6	दुर्गाजी शिरीया	"	दुर्गाजी	
7	वर्षाजी परमार	"	वर्षाजी	
8	सायुजीम मडवाडा	"	सायुजीम	
9	लीलाजी परमार	"	लीलाजी	
10	शीनाजी मन्डोया	HR	शीनाजी	
11	लायुजीम जांभवा	"	लायुजीम	
12	रुमाजी राठोड	"	रुमाजी	
13	दियुजीम परमार	"	दियुजीम	
14	दयाजी परमार	"	दयाजी	
15	भारतीजी मेराल	"	भारतीजी	
16	अरुणदाजी मडवा	"	अरुणदाजी	
17	हिरणुजीम नडय	"	हिरणुजीम	
18	पुषपाजी नडय	"	पुषपाजी	
19	रमीलाजी नडय	"	रमीलाजी	
20	मन्नीजी नडय	"	मन्नीजी	
21	निलेश राठोड	"	निलेश	
22	वजुजी शिरीया	"	वजुजी	
23	नीताजी राठोड	"	नीताजी	
24	अंजु परमार	"	अंजु	
25	राहुल राठोड	"	राहुल	
26	कमलेश राठोड	"	कमलेश	
27	पिण्याजी परमार	"	पिण्याजी	
28	इंदुजीम मन्नीया	"	इंदुजीम	
29	मुकेश सावडा	"	मुकेश	
30	दिनेश कुपडा	"	दिनेश	


(DEPARTMENT INCHARGE)


(HEAD OF DEPARTMENT)


(SVP ADMIN)

TRAINING RECORD
Fire Fighting Training
19th June, 2021
Participants – 10















Following points were discussed during training


1. Explain the different types of fire extinguishers and how they work.
2. Show the security guard how to properly use a fire extinguisher, including how to hold it, aim it and activate it. Explain the different types of fire classes and the types of extinguishers used for each.
3. Explain the basic operation of a fire pump. Show the security guard how to properly start and shut down a fire pump.
4. Explain the types of fittings and nozzles used with a fire pump. Provide instructions on how to properly operate the different types of nozzles and fittings.


nyadeya
Registrar
Marwadi University



TRAINING SHEET

SUBJECT - <u>Fire Fighting Training.</u>			SIGNATURE - 	
INSTRUCTOR - <u>Satyul Singh Jadeja</u>			DATE - <u>19-06-2021</u>	
LOCATION - <u>Wadi Area</u>			SIGNATURE - 	
ORGAIZER NAME - <u>Muhammed Bant</u>				
SR NO	NAME	DEPARTMENT	SIGNATURE	REMARKS
1	Muhammed Bant	Admin		
2	Jayant Patel	Admin		
3	Satyul Singh Jadeja	"		
4	Dhruv Bhatt	"		
5	Ashwin Vaghul	"		
6	Vishay Jashi	"		
7	Sonyl Condalok	"		
8	Jaydev Jadeja	"		
9	Abhay Ghurekar	"		
10	Jignesh Mathi	"		


(DEPARTMENT INCHARGE)


(HEAD OF DEPARTMENT)




(SVF ADMIN)

TRAINING RECORD

CPR Training

29th July, 2021

Participants - 11





Following point discussed during the training

How to recognize when a person is in need of CPR: It is important for someone receiving CPR training to understand how to recognize when someone is in need of CPR. This includes understanding the signs and symptoms of cardiac arrest, such as sudden loss of consciousness, no breathing, and no pulse.


Registrar
Marwadi University



TRAINING RECORD
First Aid Training
15th, December, 2021
Participants - 19



Summary of points that were discussed during the training are:-

1. Preventing Illness and Injury: It is important to discuss ways to prevent illness and injury, such as proper hygiene, wearing protective gear, and avoiding hazardous situations.
2. It is important to discuss safety in the workplace, such as proper lifting techniques, proper use of machinery, and how to respond to an emergency situation.
3. Likely injuries and the first aid response required to handle them.
4. The availability of Girls Common Room for rest in case of severe stomach pain or headache and the facilities needed.

nyobya
Registrar
Marwadi University



TRAINING RECORD

Security Training

11th January, 2022

Participants – 17



Following points were discussed during the training:

1. The security supervisor should be provided with an overview of the campus security system, roles and responsibilities, and the policies and procedures governing security operations.
2. The security supervisor should be trained on the procedures to be followed in the event of an emergency on campus. The security supervisor should be trained on the techniques for resolving conflicts between students, faculty, staff, and visitors.
3. The security supervisor should be trained on the maintenance and upkeep of the security system, including the proper use and care of security equipment.
4. Hostel Security. Wardens are responsible for the security of the hostels. No other security other than those allotted to Hostel will interfere in hostel affairs unless asked for through administration dept.

M. J. Jodha
Registrar
Marwadi University



TRAINING SHEET

SUBJECT - <u>Security Training</u>		SIGNATURE - <u>Davidson</u>		
INSTRUCTOR - <u>Davidson Jude</u>		DATE - <u>11-01-2022</u>		
LOCATION - <u>Meem Buidhinn</u>		SIGNATURE - <u>Davidson</u>		
ORGAIZER NAME - <u>Muhammad Pnith</u>				
SR NO	NAME	DEPARTMENT	SIGNATURE	REMARKS
1	સુરભાઈ શાહ	Security		
2	સુરભાઈ શાહ	"		
3	પ્રદીપ શાહ	"		
4	સુરભાઈ શાહ	"		
5	મીનુભાઈ શાહ	"		
6	દેવદાસ શાહ	"		
7	સુરભાઈ શાહ	"		
8	Tarshibhai Davsibhai	"	T.R	
9	સુરભાઈ શાહ	"		
10	સુરભાઈ શાહ	"		
11	સુરભાઈ શાહ	"		
12	સુરભાઈ શાહ	"		
13	સુરભાઈ શાહ	"		
14	સુરભાઈ શાહ	"	D. G	
15	સુરભાઈ શાહ	"		
16	સુરભાઈ શાહ	"		
17	સુરભાઈ શાહ	"		

Davidson
(DEPARTMENT INCHARGE)

Davidson
(HEAD OF DEPARTMENT)

Davidson
(SVP ADMIN)